


RAN-2408000604020006
S.Y.B.Com. (Sem. IV) Examination October - 2025
Banking Law & Practice III - Major
Time: 2 Hours]
[Total Marks: 50
સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the above details on your answer book

Seat No.:

--	--	--	--	--	--

Student's Signature

- પ્ર-1. નીચેના પ્રશ્નોનો ટૂંકમાં જવાબ આપો. (ગમે તે પાંચ) (10)**
- 1) ચેકનો અયોગ્ય નકાર એટલે શું?
 - 2) ચેકની વસુલાત એટલે શું?
 - 3) લોનનો અર્થ સમજાવો.
 - 4) CIBIL નું પૂરું નામ જણાવો.
 - 5) CASA ડિપોઝીટ એટલે શું?
 - 6) યથાનુક્રમે ચુકવણી એટલે શું?
 - 7) એકાઉન્ટ પેઈ કોસિંગ એટલે શું?
- પ્ર-2. ચેકના નાણાં ચુકવતી વખતે બેંકરે રાખવાની તકેદારીઓ સમજાવો. (14)**
- અથવા**
- બેંક ધિરાણના સામાન્ય સિદ્ધાંતો સમજાવો. (14)**
- પ્ર-3. (અ) લોન મંજૂરીની પ્રક્રિયામાં સિબિલ સ્કોર (CIBIL Score)નું મહત્વ સમજાવો. (07)**
- (બ) બેંકો માટે CASA ડીપોઝિટનું મહત્વ સ્પષ્ટ કરો. (07)**
- અથવા**
- પ્ર-3. (અ) નાણાં ચૂકવનાર બેન્કરને અપાયેલ કાનૂની રક્ષણની સમજૂતી આપો. (07)**
- (બ) લોન માટેના વિવિધ છુપા ચાર્જસ (Hidden Charges) સમજાવો. (07)**
- પ્ર-4. (અ) ગમે તે એક પ્રશ્નનો જવાબ આપો. (06)**
1. બચત ખાતા અને ચાલુ ખાતા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.
 2. ટૂંકનોંધ લખો : રક્ષિત ધિરાણ અને બિનરક્ષિત ધિરાણ
- (બ) નીચેના સંજોગોમાં બેંકર તરીકે તમે શું કરશો? (06)**
1. ચુકવણી માટે રજૂ થયેલ ચેકમાં લખનારની સહિ નથી.
 2. બેંકનો એક ગ્રાહક જે સરકારી કર્મચારી છે જે હાઉસિંગ લોન માટે બેંકમાં અરજી કરે છે. બેંકમાં લોનની કાર્યવાહી કરવા માટે જરૂરી દસ્તાવેજો પણ આપે છે. બેંકર તરીકે સિબિલ સ્કોરની ચકાસણી કેવી રીતે કરશો?

ENGLISH VERSION

- Q-1. Answer any five of the following in short. (10)**
1. What is wrongful dishonour of cheque?
 2. What is meant by collection of cheque?
 3. What is meant by loan?
 4. Give the full form of CIBIL.
 5. What are CASA deposits?
 6. What is the payment in due course?
 7. What is Account payee crossing?
- Q-2. Explain the precautions that a banker has to take while making payment of a cheque. (14)**
- OR**
- Q-2. Discuss the General Principles of Sound lending. (14)**
- Q-3. (A) Discuss the importance of CIBIL score in loan approval process. (07)**
(B) Explain the importance of CASA deposits for bank. (07)
- OR**
- Q-3. (A) Explain the legal protection provided to a paying banker. (07)**
(B) Describe the hidden charges related to the loan. (07)
- Q-4. (A) Answer any one from the following. (06)**
1. State the difference between saving account and current account.
 2. Write a short note on Secured loan and Unsecured loan.
- (B) What would you do as a banker in the following situations? (06)**
1. A cheque is presented before you in which the signature of drawee is not mentioned.
 2. One of your customers who is a government employee applies for a housing loan. He also provides the necessary documents for processing the loan. As a banker, how would you check the CIBIL score?
-